



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૫/૦૪/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૬૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૧ કેસ કરી, ૬૨ વ્યક્તિઓને ઝડપી, ૩૩૪ લીટર દેશી દારૂ અને ૫ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી ૨૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૮,૨૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૬૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૪૧૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૬૬૩/૧૯

વેજલપુર : જાએદાબેગમ મોહનુદીન કાઝી (ઉ.વ.૭૩)(રહે,રહેનુમા સોસાયટી, એફ.ડી.સ્કુલની સામે, જુહાપુરા) એ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૪/૨૦૧૯ ના કલાક ૧૦/૩૦ થી ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના ઉપરના માળનો દરવાજો ખોલી, અજાણી વ્યક્તિ ઘરમા પ્રવેશ કરી, કબાટમાંથી સોના-ચાંદીના દાગીના કુલ કિંમત રૂપિયા ૬૫,૦૦૦/- મતાના તેમજ જરૂરી દસ્તાવેજોની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી.વણઝારા ચલાવે છે.

શાહપુર : સુરેશભાઈ મુળજીભાઈ પટેલ (રહે.સુદર્શન એપાર્ટમેન્ટ ગણેશ વિધાલય ની સામે રામજી મંદીર રોડ રાણીપ) એ તા.૧૪/૦૪/૨૦૧૯ ના રોજ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આશરે એક માસ અગાઉથી તા.૧૪/૦૪/૧૯ સુધીના સમયગાળા દરમ્યાન શાહપુર દિલ્હી દરવાજા કાણીખાનનો મહોલ્લા ખાતેના ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના આશરે ત્રીસ થી પાત્રીસ હજાર મતાના ચોરી કરી લઈ ગઈ છે.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ઓ.તિવારી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૬૬૪/૧૯

વાડજ : ઓલિવર ધીરજલાલ ખંભાતા (ઉ.વ.૭૬)(રહે. નાગરેપ કોલોની જય સોમનાથ સ્કુલની પાસે સાપોન નગર ખોખરા)એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૪/૨૦૧૯ રાતના ૦૮/૦૦ વાગ્યાના સુમારે જુના વાડજ સર્કલ પાસે એક અજાણ્યા પુરૂષે ઓલિવરભાઈ ને “તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે” તેમ કહી તેમની નજર ચુકવી તેમની બેગ કે જેમાં રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા પરચુરણ કાગળો મુકેલ હતા તેની ચોરી કરી લઈ નાસી ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એન.ચૌધરી ચલાવે છે.

વટવા : આનંદભાઈ પ્રભાકરભાઈ તારગે (ઉ.વ.૪૩) (રહે. ધનલક્ષ્મી સોસાયટી ગોપાલ ટાવર સામે વટવા) એ તા.૧૪/૦૪/૨૦૧૯ ના રોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૦૩/૧૯ સવારના ૭/૦૦ થી ૧૦/૦૦ સુધીના સમયગાળા દરમિયાન પોતાના સર્જન ઈંડસ્ટ્રીયલ પાર્ક મા આવેલ દુકાન નં-૨૬ ખાતેના ગોડાઉન માંથી પોતાની દુકાનનો કારીગર સીરાજ (રહે. જમાલપુર) તથા તેનો મિત્ર (જેના નામ- ઠામની ખબર નથી તે) નાઓએ ભેગામળી ગોડાઉનમાંથી જુદી-જુદી કંપનીના કુલ-૧૩ એ.સી. જેની કુલ કિંમત રૂપિયા ૧,૯૫,૦૦૦/- મતાના ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એમ.દેસાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૬૬૫/૧૯

ઓઢવ: સુધીર ઉર્ફે રીંકુ સતીષભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬) (રહે. સુહાગીબેનની ચાલી ખોડીયારનગર ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૧૪/૪/૧૯ સાંજના ૭/૩૦ વાગ્યા પહેલા પોતાના ઘરે એંગલ સાથે દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કાંતીલાલ જીવાજી ચલાવે છે.

નારોલ: રવિભાઈ રમેશભાઈ પટેલ (ઉ.વ.૨૪) (રહે. આકૃતિ આંગણ ફ્લેટ સનરાઇઝ હોટલ પાછળ નારોલ- અસલાલી હાઇવે રોડ નારોલ) એ અગમ્ય કારણસર તા.૧૪/૪/૧૯ રાતના સમયે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમણભાઈ હીરાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.